

## Review Questions

Due: Nov. 29, 2018

- 1 T ક્ષેત્રીય કામો માટે જીવ અને શરીરને એક સમતા માળ્ય હોય.
- 2 F સંપત્તિ, સ્વામી પ્રત્યેના શાંતિ દૂર તરવા તે દુઃખ વિવેક કરવાય.
- 3 F દર અને માનમાં ભુલ હો તો અનુભવ તરવા તે આવક છે.
- 4 F જીવ દુઃખ અનિવર્ય છે.
- 5 T પુદ્ગલ દુઃખ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળું છે.
- 6 F પુદ્ગલ કરતાં જીવમાં જ્ઞાન, દર્શન ગુણ વધારે છે.
- 7 F જીવ અને અજીવનું સામ્યજ્ઞાન થવું તે વિવેક કરવાય.
- 8 F પુદ્ગલનું જન્મ જીવ પણ પરિવર્તનશીલ છે.
- 9 F માનમાં સ્વામી અસિદ્ધ્ય રાવે શિક્ષા માર.
- 10 F જીવ અને અજીવનો ભેદજ્ઞાન વડે અનુભવ બાહ્યવસ્તુઓમાં પણ હોઈ શકે.
- 11 T અજીવનું તરવા ઉદ્ધારની સંભાવના તમા કરવાય.
- 12 F શરીર અને માનમાં ભેદજ્ઞાન સંસ્કૃતિ પંચેન્દ્રિય નિર્વ્યયોને દર્શ શિક્ષા, અધ્યાત્મ રાવે શિક્ષા.
- 13 T નિશ્ચયનય પ્રમાણે માનમાં કર્મને કાર્ય કે ભોલતા નહીં.
- 14 T આવકો જીવ મારવા ઉદ્ધારના તરવા પદ્ધતિને ચોતાનું માન છે.
- 15 F દર્શનાવસ્થા, જ્ઞાનાવસ્થા તમે માનમાં કર્મ કરવાય.

- ૧૭ F આ અબરૂઆં વિષયનો શાસ્ત્રનો ઉપમા આપી છે.
- ૧૭ F વ્યવહારના વધુ પરપદો પ્રત્યેક આસક્તિનો વ્યાગ તરફનો સંયમ તરફાય.
- ૧૮ I સ્વદેશીય તરફ જાનાવરણીય તમ વૃદ્ધી.
- ૧૯ F શરીરનો રંગ કાળો કે ગરો મળવો તે ગોત્ર જાનું કારણ છે.
- ૨૦ I જ્ઞાન દાન ભક્ષિતરમાં પણ ઉપાર તર છે.
- ૨૧ F રૂઝા અટલે સાર અને ઉપદેશ અટલે શાસાર.
- ૨૨ I મોરબી ઉદેશી ઉલ્લેખ દેતી વિભાવદશા તે ભાવ કર્મ કરવોય.
- ૨૩ F જલ્લા નવા ભવામાં અવ દુષ્ટ બદલાયા કર છે.
- ૨૪ F પ્રાચીન અને જાણ તર છે.
- ૨૫ F સંસ્કૃતિ કી આલોક શાપી.
- ૨૬ I ઉદેશીય અને તરવોય આત્મા કીય તર છે.
- ૨૭ I જ્ઞાનાવરણ, દરજાવરણ વગેરે ન કર્મ ન દુષ્ટાતમ કરવોય છે.
- ૨૮ F "જલ્લા નવા ઉલ્લેખ દેતાં ગુણો અને પર્યાયો આત્મા ન પાત્ર છે" આ વાક્યને "અપાદાન" કારણ કરવોય અને કારણ કરવોય.
- ૨૯ I આત્મા અને ગુણપર્યાયો આ કીય તરવોય આત્મા "અધિરણ" છે.
- ૩૦ I શરીર, રૂઝી, મક્કાન, સંપત્તિ વગેરે જાણ વધારોને "જાકમ" તરવોય છે.